

627

श्री जैन धर्म प्रकाश

JAINA DHARMA PRAKASHA.

पुस्तक ८ रु. आवण सुदूर १५ संवत् १९४८ अंक. ५ मे

शार्दूलविक्रीडित.

कृत्वा हृतपदपूजनं यतिजनं नत्वा विदित्वागमं ।
 हित्वा संगमधर्मकर्मठधियां पात्रेषु दत्वा धनं ॥
 गत्वा पद्धतिमुत्तमकमजुषां जिच्चांतरारित्रिजं ।
 सत्वा पञ्चनमस्तिथां कुरु करकोडस्थमिष्टमुखं ॥२॥

प्रगटकर्ता.

श्री जैनधर्मप्रसारक सभा
 आवनगर.

अमदाबादमां—“अंबेला वर्नाइयुलर भ्रीन्टींग ग्रेसभां”
 नथुभाई रतनचंद्र भारदतीयामे छापी प्रसिद्ध कई
 श. १८१४. सन १८४२
 मूल वर्ण १ नो ३१) अगाडीपोस्टेज ३०-३-० झू.६०.
 छुट्टे अंक अंकना ३०-२-०

अनुक्रमणिका.

विषय	पृष्ठ
१ विवेक (पृथ.)	६५
२ प्रभाकिपत्रः.	६६
३ भाष्या (श्री भद्रीनाथ यस्त्रिन).	६८
४ संघोधसत्तरी (ज्येष्ठा).	७२
५ भनुष्य ज्ञनम्.	७४

ग्राहानीयुः रभृतुः मुक्तीने आशातना करनी नहीं।

ग्राहकोने भेट.

श्री नलदमयंती चरित्र.

जे जे ग्राहकोने लवाज्ञम् मेाडलावेल छे तेमां भेटनी युक्तना पौस्टेज्ञो अरवेदा आनो वथारे मेाडलनारने भेट मेाडला-वेल छे, भाडीना ग्राहकोने अरवेदा आनो मेाडली युक्त भंगावी लेवी साथे नवा वर्षतुः लवाज्ञम् मेाडलरो तो अनुकूल पडवे।

लवाज्ञम् मेाडलवाना आणायु ग्राहकोने हुल्लु पण भेटनी युक्तनो लाल लेवो हाय तो घउत्सा लवाज्ञम् साथे नवा वर्षतुः लवाज्ञम् अने भेटनी युक्तनी पौस्टेज्ञो अरवेदा आनो मेाडला-वेल एट्से तेमने भेट मेाडलवाश्य।


पुस्तकोनी पहेला.

मोक्षमाळा अने भावनावीथ—शा. क्यराभाष्ठ ग्रापाणहास श्री अभद्रावाद निवासी तरङ्गथी भेट दाखल भणी छे ते स्त्रीकारीभी छीये, कीमत ३ ।) अने ३ ।। छे, डेकाष्ठ भनायुतानी पोणमां पडीपैणमांधी भणयो, घने युक्त संपूर्ण दीते वांचया योग्य छे, अभारी पासेथी पण भणयो।

१ मोक्ष माळा २ वैराग्य शतक ३ नित्यनियमरी पोथी ४ ओ-गणपत्यास भांगा—ये चार युक्त शा. भालाभाष्ठ छगनलाल अभद्रावाद निवासी तरङ्गथी भेट दाखल भणी छे ते स्त्रीकारीभी छीये, मोक्षमाणानी युक्ततुः उपयोगीपत्रः भतावनार हुँडील तेमना तरङ्गथीज्ञ आ अङ्कमां वांचयामां आवेल छे, तथी ये आखतमां विशेष विवेचन लभ्यानी जड़िर नथी, कीमत योक्त ३ पीथा छे, ये युक्त अभद्रावादमां कीकालटनी पोणमां तेमनी पासेथी तथा भावनगरभां अभारी पासेथी पण भणयो, जेझ्ये तेषु भंगानी लेवी, युक्त वांचयाथी हायहो कडे संती छे, घने ज्येष्ठ तरङ्गथी भणेती मोक्षमाणानी युक्त एकज्ञ जातनी छे।

શ્રી જૈનધર્મપ્રકાશ.

JAINA DHARMA PRAKASHA.



પુસ્તક ૮ મું. રૂક ૧૮૧૪ આવણ શુદ્ધ ૧૫ સંવત ૧૯૪૮ અંક ૫ મે.

વિવેક.

(રાગ મહાર.)

વનથર વીરા રે વધામણિ, કહેને ક્યાં થકી આવ્યો; એ રાહું	
વિવેક વધારો સૌ પ્રીતથી, જશ પામશો જગમાં;	
અધિક ધર્મતથી આપશો, વેગે વધશો વગમાં. વિવેક૦ ૧	
વિવિધ વિદ્યા ભજે ભાવથી, શાખ બહુ મન ધારે;	
હુનર હાય કરે ધણાં, વિના વિવેક તે હારે. વિવેક૦ ૨	
હૃદય ભૂમિમાં ને વાવશો, વિદ્યા વૃક્ષજ ચાડ;	
વિવેક ચારિશ્રેણે સિંચશો, થાશે સશ્વત તે સાંદ. વિવેક૦ ૩	
લક્ષ્મી વરી પ્રેમે સંપને, વિદ્યા વરી છે વિનયને;	
ક્રીતિં વરી છે વિવેકને, જુવો જગતમાં નયને. વિવેક૦ ૪	
હોય હશે કહી આપમાં, પણ વિવેક જે મનમાં;	
નેમ કલાક ચંદ્ર કીર્ણમાં, તેમ લય થાય ક્ષણમાં. વિવેક૦ ૫	
મણિ મુક્તાકુલ રતનના, આલુપણ અંગ ધરશો;	

૧ સુંદર. ૨ પાણી. ૩ નેત્રે.

૬૬

શ્રી જૈનવર્મા પ્રકાશ.

વિવેક વિભૂતયુ નહીં ધરો, ભાર અંગને કરશો.	વિવેક૦ ૬
બ્રહ્મ હસ વણું ક્ષેત્ર છે, બન્ને સરોવર વસતા;	
૩ પ્રય-જળ લેદ વિવેકથી, રાજપદ હસ ભજતા.	વિવેક૦ ૭
વિવેકથી વિદ્યા ખીલશો, વિદ્યાયે તત્ત્વ ધરશો;	
* નર્મદ તત્ત્વના એધથી, ગાની થઈ કરી ધરશો.	વિવેક૦ ૮

પ્રમાણિકપણું.

બ્યવહાર નિતિના જાણ અને ધર્મની અધ્યાત્માના દરેક મનુષ્યોએ પ્ર-
માણિક રહેવાની ખાસ જરૂર છે. જેઓ પ્રમાણીક નથી તેઓ નીતિવાનું પણ
નથી અને ધર્માદ્ય પણ નથી એમ સમજવું. ઉપરથી નિતિવાનનું તોણ રા-
ખવું અને અંદરથી અનેક પ્રકારના પ્રપણો કરવા, છાંકપટ ચલાવવું, વ્યાજથી
ખાયતમાં ચાયવા હેવા લેણું આં વાંધો પાડવો, છતી શક્તિએ ડાઢિવું લોણું
આપવું નહીં, ગરીબ રાડીરાડો જેમણે આજીવીકાને માટે આપી છાંગા.
નીતું સાધન વિદ્યાસપ્ત સેંપેલ હોય તેને છતી શક્તિએ રોવરાવી અને
ખીળ પણ અનેક અધ્યાતી હૃદ્યો કરવાં તે એવા મનુષ્યોને ડાઈ પણ રીતે
ધરીત નથી. એમ કરવાથી પ્રતી તેઓ નિતિવાનું કે ધર્માદ્ય ગણ્યાતા નથી
અને જીવલા નિતિને અને ધર્મને લખવાને છે. લોડો કહે છે કે જુઓ આ
નિતિવાના ! જુઓ આ ધર્માદ્ય ! જુઓ આ સાધર્મી ! કદી પોતાની વાત
વ્યાજથી હોય તો પણ વ્યારે આવી નિંદા થતી હોય લારે તેની લોક
નિંદાના નિવારણની આતર પોતે તુકશાની સહન કરતી જોઈએ તો જ્યારે
પોતાની વાત વ્યાજથી ન હોય—પોતાનું મન પણ વ્યાજથી નથી એમ
સાક્ષી પૂરતું હોય લારે પછી ઇક્તા દ્રવ્યના લોભમાં પરવશ થઈને નિતિની
કે ધર્મની નિંદા કરાવવી એ સમજું મનુષ્યનું કર્તાવ્ય નથી તેઓએ તો જેણ
અને તેમ વિશેષ પ્રકારે પ્રમાણિક રહેવાની જરૂર છે વળી કરી પ્રપણે કરી-
ને આ ભવભાં તો ડાઈનું દેણું ન આપીએ તો પણ આવતા બધને વિંશ
પણ દીધા વિના છુટકો થતો નથી. એમ શાસ્ત્રજ્ઞરોએ કહેલું છે. આ સ-
ખંધમાં શ્રી દાયાંત શતક અંધમાં એક શ્લોક નીચે પ્રમાણે છે—

૧ બગડો. ૨ ધોળા. ૩ દુધ. ૪ સુખ આપનાર.

प्रभाष्टिकपञ्चः.

६७

भोजार्ण हि विधाय पारभविकं तैल्यालये च स्थितो,
वृत्तांतं प्रतिकर्ण्य स हनुमुहोर्द्वद्वा प्रभातेऽस्तिलं;
गत्वा भोजगृहं समर्प्य सकलं भंडारिकानां धनं,
तान्प्रोचे तदृणं क्षमोऽन्य भविकं दातुं न गेहे गतः ॥१॥

आ श्वेतमां भावार्थं अवेदे छे के—अक्षरा डोर्डीभेद वाणीआओ अेतु
नियार्थे के ‘आ भवमां लीघेतुं दीघेतुं हेय ते परभवमां पाषु देवातुं टे-
वातुं’ नथी माटे आपणे आनन्दा भवने करारे डोर्डी पासेथी द्रव्य लाई आ-
वनुं’ पक्षी तेजे ज्ञानराजने उद्धर नाणीने तेनी पासे ज्ञने क्षेत्रे के ‘हुं
आवते जन्मे तमने एक लक्ष इपैया व्याज सहित आभीश. क्षेत्रो अत
करी आपुं’ ज्ञानराजने अत करानी लाई आपवा हा क्षी, एट्से तेजे
तो अत करी आपुं अने लक्ष द्रव्य लाई आवी रात्रीभे डोर्डी धांचीने लां
रात्रीवास्ते रख्या. अर्ध रात्री थाई एट्से धांचीना अने अणदो परस्पर वा-
ता करना लाभ्या. तेमां प्रथम एक अणद ने के धाणीना असंत प्रयासथा
भडुज दृश अने भृत्यु तूल्य थयेदो होतो ते ऐलो डे ‘भारे तो पूर्वं ज-
न्मना देवाभांथी धांचीनो भाव एक नांधीजोज हेवा रख्या छे. एट्से क्षेत्रे
सवारे हुं आर देवा धाणीना द्धने हेतुं पुहुं करी भरणु पाभीश एट्से
हेवाथी छुंगीश अने परभवे सुणी थाईश.’ लारे भीने अणद ने के लक्ष-
पुष्ट होतो ते ऐलो डे ‘भारे तो धांचीतुं पूर्वं जन्मनुं हज्जु एक लक्ष द्रव्य
हेतुं रह्युं छे, ते आवी रीतनी भज्जुरी तो जन्म पर्यंत कइं तोभणु कांઈ
पूर्वं थाय तेम नथी. परंतु जे आ वाणीजो सुतेक्षा छे ते सवारमां ज्ञान-
राजनी पासे ज्ञने क्षेत्रे के तमारा पट्टहस्ती साये आ धांचीना अणदने
लग्यावो अने जे अणद ज्ञने तो धांचीने तमारे लक्ष इपीआ आपवा. आ
प्रगाणे क्षेत्राथी ज्ञानराज जे क्षमुख करे तो हुं रोता पट्टहस्ती साये क्षी
तेने अतीने धांचीना लक्ष द्रव्यना नक्षुभांथी छुंगे अने ज्ञानराजनी पासे
भारा पूर्वं भवना लक्ष इपैया लेण्या छे ते ए प्रश्ने आवी नाय एट्से
लेण्या हेवा अनेभांथी छुंगीने भरणु पाभी परभवे सुख पासुं.’ आ वात
वाणीआओ सांबणी एट्से तेने तो चरपटी थवा लागी के शुं! वणी पर-
भवनी रारते करेक्षुं हेतुं आम अणद थाईने पणु हेतुं पडे? ना ना एम
होय नदी! माटे चाल आपणे तो आ वातनी ज्ञर आत्री कर्वी अने

૬૮

શ્રી જૈતંધરી પ્રકાશો.

જો એમજ હોય તો લીધેલું દવ્ય બોજરાજને પાછું દઈનેજ થરે જવું. સ-
વાર થઈ એટલે પહેલા અળફને ધાંચીએ ધાણીઓ જોડ્યો. બહુજ
અશક્ત અને જુંબ થઈ ગયેલ હોવાથી ચાર ક્રેઝ ફોં લાં તો પડીને
મરણ પામ્યો. વાણીઓને એક વાતની તો ખાની થઈ એટલે ચરપદી વધી
પડી અને એમ ખાની થવા ભાંડી કે પરભવમાં પણ જરૂર હેવું પડે છે.
વધારે ખાની કરવા માટે તરતજ તે બોજરાજ પાસે ગયો. અને રાત્રીની
હકીકત વધાર્ય કહી અતાવી. રાજ નાણતોજ હતો કે પરભવમાં હેવું પડે
છે તો પણ પોતાની અને વાણીઓની વિશેષ ખાની કરવા સારુ તરતજ
તેણું ધાંચીના અળફને અને પોતાના પદહરિસ્તને ખોલાવી અનેને લડાવ્યા.
બળદ મહા જોરાવર હોવાથી જીત્યો એટલે રાજને ધાંચીને લક્ષ દવ્ય આ-
ચ્યુ અને અળફને ધાંચીના રખુંબાંથી છોડાવ્યો. વાણીઓ પણ ડાંણો એટલે
તરતજ લીધેલું લક્ષ દવ્ય રાજને પાછું આપ્યું અને કરાર રહે કરાતી પોતાને
થરે ગયો કહું છે કે—

ઇહ ભવ હેણું હોહિલું, પરભવ વળી વિશેષ;
દાંત સાંભળો બળફનો, તજએ રણું અરોપ. ૧

ઉપરના દાંતં ઉપરથી સાર એ લેવાનો છે કે આ ભવમાં કરેલું
હેવું પ્રમાણિકપણે વર્તની દઈ હેવું. એ આખતની ઉપેક્ષા કરવી નહીં. ઉપેક્ષા
કરવાથી પરભવમાં વિશેષ દુઃખ સહન કરવું પડે છે. આ સંખ્યાખ્યમાં શ્રી
હિત શિક્ષાના રાસ વિગેરમાં પણ અધિકાર છે કે પૂર્ણા કેટલાક લેણુદાર
થઈને આવે છે અને કેટલાક હેવાદાર થઈને આવે છે. લેણુદાર પુત્ર ગર્ભમાં
આવે લારથી અનેક પ્રકારના સાંસારીક ખર્ચો કરાવે, જન્મ મહોત્સવમાં
ખર્ચ કરાવે એમ કરતાં કરતાં જેટલું લેણું હોય તેટલું પુરં થાય કે અન્ય
ભવમાં ગમન કરે અર્થાત् મુત્ય પામે. હેવાદાર પુત્ર ગર્ભમાં આવે કે ઘરમાં
લક્ષમીની વૃદ્ધિ થાય, ચારે ખાળુંથી આપાદાની થાય અને જનમાં પણ
પણ વધે વૃદ્ધ પામીને સારી પેડે લક્ષમી ઉપરાજન કરી માતા પિતાની ભ-
ક્ષિત કરી હેવું પુરં કરે. તેથી સાર એ અહણ કરવાનો છે કે કેઠિનું દવ્ય
છતી શક્તિએ બધાનાત કરીને પચાંચી પડવું નહીં. કેમકે આ ભવમાં ન
આપીએ તો પરભવમાં પણ હેવું પડે છે. અસવિસ્તરેણ!

—નાનાનાના—

માયા.

૬૬

માયા.

શ્રી મલ્લીનાથ ચરિત્ર.

(સાંખ્ય પાઠે ૬૪ થી.)

આ નાનુદ્વિપના ભરતક્ષેત્રમાં મહાવિહેદ ક્ષેત્રને વિષે મેર પર્વતની પદ્ધિતિ હિંદુશાસ્ત્રે નિયમ પર્વતની ઉત્તરે અને રીતોદાના દક્ષિણ તટે, સુખાવહ નામના વાસારગિરિની પદ્ધિતિ હિંદુશાસ્ત્રે તેમજ પદ્ધિતિ હિંદુશાના લવણુ સમુદ્રની પર્વતે સહિતાવતિ નામે વિન્યસે છે. તે વિન્યસમાં વીતશોકા નામે અતિ સુશોભત ખાર યોજન લાણી અને નવશોજન પહોળી નગરી છે. તે નગરીમાં ખણ્ણ નામે રાજ રાજ્ય કરતો હતો. તેને ધારણી પ્રમુખ એક છન્નર રાણીઓ હતી. એકદા ધારણી રાણીએ રાનીને વિષે સુખ સચ્ચામાં સુતાયકા સિંદુર સ્વરૂપ દીઠું હેખાને જગી. પ્રાણપતિને વાત કરી. અતુક્રે પુત્ર પ્રયત્ન થયો તેનું મહૃાયણ નાગ રાઘવું. યોગ્ય વચ્ચે વિદ્યાભ્યાસ કરવા મુક્તો. સમર્સ્ત નિધા ભણી પ્રતીષ્ઠ થયો. અતુક્રે યૈવન પામવાથી કુમારશ્રી વગેરે પાંચશે રાજ્યકન્યા સાથે પાણિચણું કરાવ્યાં. તે મહૃાયણ કુમાર પાંચશે સ્વીમાની સાથે અનેક પ્રકારના સાંસારીક લોગ લોગને છે. એવા સમયમાં એકદા પાંચશે મુનીના પરીવારે પરવર્યા, આમાતુથામે વિહાર કરતા, સુખ સમાધિઓ આહત સાધન કરતા શ્રી ધર્મધોષ નામે સ્થવીર મહારાજન તે વાતશોકા નગરીના દ્વિકુલ નામના ડ્વાનમાં સમોસર્યા.

વનપાળએ વધામણી દીધી એટસે ખળરાજ મોદા આડાર સાથે વાંદવા આવ્યો. દેશના સાંભળો, પ્રતિસોધ પામી, મદાયણ કુમારને રાજ્યે સ્થાપન કરી, સ્વહસ્તે કેશ લુચન કરીને તેમજે દિક્ષા અંગીકાર કરી. ખણ્ણરાજણી અન્યાર અંગના જાણ થયા. ધણા વર્ષ પર્વત શ્રામણ્ય પર્યાય પાળીને પ્રાંતે એક માસની સંલેખણું કરી વાતી ઘનધાતી કર્મનો ક્ષય કરી ક્રષણજીનાન પામી મોક્ષ સુખ પ્રલે પામ્યા.

હવે મહૃાયણ કુમાર રાજ્યનું પ્રતિપાળન કરે છે. એકદા તેમની પદ્ધરાણી કુમારશ્રીને સિંદુરસ્વરૂપ સચિત પુત્ર થયો તેનું ખલિલદ્ર નામ સ્થાપન કર્યું. તે મહૃાયણ રાજને આચળ ૧ ધરણ ૨ પૂરણ ૩ વચ્ચુમિત્ર ૪ વૈક્રમણ ૫ અને અગનિયંત્ર ૬ નામે છ મિત્રો છે. પરંતુ જનમથીજ સાથે

વૃદ્ધિ પાખ્યા, સાથે કિડાઓ કરી, સાથે વિદ્યાભ્યાસ કર્યો અને સાથેજ સુ-
પુનિરાજ અતુભવ કરેલ હોવાથી પરસ્પર ગાડ રોહ વર્તે છે. દેશ મહેશ
ગમન પણ સાથેજ કરે છે તેમજ જે કરવું તે સાથેજ કરવું એમ પરસ્પર
દઠ પ્રાંબ કરેલો છે.

એકદા વળી તેજ શ્રી ધર્મધોય સુનિરાજ ઈંડ્રકુંભ નાગના ઉદ્ઘાનમાં
સમોસંધ્યા. આવક આવીકાઓ વંદન કરવા ગયા. મહાયા રાજ પણ પોતા-
ના પરીવારે પરવર્યો સતો વંદન કરવા ગયો. તેમના ચુંઘાતુલ્ય ઉપહેશને
અવણુ કરીને તત્કાળ પ્રતિભેદ પાખ્યો. પણી યુર મહારાજની આશા લઈને
પુનને રાન્યે સ્થાપના અને પરુ મિત્રની રજ લેવાને માટે પાણો નગરમાં
ચારિત્ર અદ્ધણ કરવાના અભિલાષ સાથે આવ્યો. પ્રથમ પોતાના મિત્રને
ઓદ્ધારીને કરું કે—હે પ્રિયમિત્રો મારો નિયાર દિક્ષા અદ્ધણ કરવાનો થયો
છે. માટે તમારો નિયાર થું છે? મિત્રો એલાયા કે હે હેવાનું પિય! હે મહા-
રાજ! જ્યારે તમે દિક્ષા લો છો તો પણી આમારે ઓન્ને કાણું આધાર ભૂ-
ત છે માટે અમે પણ તમારી સાથે દિક્ષા અદ્ધણ કરશું.

મહાયા—હે બાળમિત્રો! ને તમે મારી સાથે દીક્ષા લેવા તત્પર
છો તો તમે પોતપોતાને ઘરે જાઓ અને પોતાના એષ પુનને ગૃહભાર સેં-
પીને ચારિત્ર અદ્ધણની સામન્યી સહીત સુખાસનમાં એસીને અહી આવો.
મહાયા રાજની આ પ્રમાણે આશા થાયાથી તેજો તરતજ પોતાને ઘરેન-
થી એષ પુનને ગૃહભાર સેંપી શિણીકામાં એસીને લાં આબ્યા એટલે મહા
અધિરાજને પણ પોતાના ઘણીલદ્ર નામના કુમારને રાજ્યાન્ધેક કરાવી તે-
ની રજ લીધી અને મોટા મહોસુષ પૂર્વક એક મોટી વિશાળ પાલણીમાં
એસી છ મિત્રો સહીત વિતરોકા નગરીના મંદ્ય ભાગમાં થઈને ન્યાં ધર્મ-
ધ્યાય સ્થવીર ભગવંત ભીરાને છે તે ઈંડ્રકુંભ નામના ઉદ્ઘાનમાં આબ્યા. અ-
ને સ્વહૃતે પંચમુઢી લોચ કરીને તેમના સમીપે સાતે મિત્રાઓ દીક્ષા અદ્ધણ
કરી. આખાર અંગ ભણ્યા અને અનેક પ્રકારની તપસ્યા કરતા સત્તા પો-
તાના આત્મ સ્વરૂપને ભાવતા વિચરવા લાગ્યા.

શ્રોદ્ધા સાતે મિત્ર સુનીજાએ શ્રોદ્ધા થઈને માણણમાંહે એંધો નિર્ણય
કર્યો કે “આપણે સાતે જણુંઓએ એક સરખા તપને કરતા સત્તા વિચ-
રતું.” મહાયા કુમાર સહીત સાતે સુનીજા તે પ્રતિજ્ઞાના નિર્ણયક કરતા
એથ, છંકુ અને આકુમાહિક તપસ્યાને કરતા સત્તા વિચરે છે. શ્રોદ્ધા મહા

માયા.

૭૨

જ્ઞાતરાજાંથિને સ્વીપણુંનું નિબિદ્ધ હોયાથી અને મિથ્યાઅભિમાનની પ્રાગતા હોયાથી એનો વિચાર ઉત્પન્ન થયો કે આ છ મુનીઓ સંસારીપણામાં મારા સેવક હતા અને હું નાયક હતો તો ઈંડાં મુનિપણામાં પણ કાંઈક અંતર નોટાયો. તેના સરળોજ તપ કરવો જને યોગ્ય નહીં, મારે કાંઈક નિશ્ચય તપ કરો નોટાયો. જે કે અમે પરસ્પર પ્રતિઅંધ કરેલો છે પરંતુ તેમને જણ્ણાંયા શિવાય મારે વિશેષ તપ કરવો.

આ પ્રમાણેનો તીવ્યપણે વિચાર કરવા થકી તેજ સમયે મહાાગ મુનીએ મિથ્યાત્મ ગુણુદ્ધાણું અનુભવીને સ્વી નામ કર્મનો પ્રતિઅંધ કર્યો.

હું જ્યારે મહાાગ વિના જીવન છ મુનિઓ એક ઉપવાસ અંગીકાર કરીને વિચરે છે લારે મહાાગ મુનિ એ ઉપવાસ કરે છે; જ્યારે છ મુનિ એ ઉપવાસ કરે છે લારે તે લણુ ઉપવાસ કરે છે, જ્યારે છ મુનિઓ વણુ ઉપવાસ કરે છે લારે તે ચાર કરે છે આ પ્રમાણે તેઓને વણ્ણાંયા શિવાય વિદ્ધ પામતી તપસ્યા કૃપા કરીને કરતા થકા વિચરે છે. અનુકૂળે તે મહાાગ મુનિઓ શ્રી વીશ્વાનાનદ્દનું ખાડુ વખત અનોક પ્રકારના તપવડે સેવન કર્યું અને તેથી તીર્થિકર નામ કર્મ ઉપાક્રિત કર્યું. તે વીશ્વાનાનદ્દ તપનો વિસ્તાર શ્રી જીતા સુત, પ્રવચન સારોદ્ધર તથા આચાર દિનકરાહિક અંથ થકા જાણવો.

લાર પછી તે મહાાગ વિગેરે સાત મુનીઓએ મુનિરાજની આર પ્રતિમાનું વહન કર્યું અને પછી લધુસિંહનિ:કૃદિત અને મહા સિંહનિ:કૃદિત તપ કર્યો. આ તપ ખાડુજ કરીન છે એનો વિસ્તાર પણ પૂર્વોક્ત શાસ્ત્રોમાંથી જોણો. આ પ્રમાણે તે સાત મુનીઓ શરિરની ભમતાનો પરિપૂર્ણપણે લાગ કરીને અનોક પ્રકારના તપ આચરતા સત્તા માંસ ઇધીર રહીત હાડ ભાવ શરીરવાગ થયા. પછી આયુષ્યના પ્રાંત ભાગે સ્થવીર ભગવંતની આત્મા લઈને વક્ષસ્કાર પર્વત ઉપર ચડી એ માસની સંલેખણું કરતા હવા. ચોરાશી લાખ વર્ષ ચારિવ પણ્યોયને પાળી ચોરાશી લાખ પૂર્વના સર્વ આયુષ્યને સંપૂર્ણ કરી શુભ બાવે કાળ કરીને જ્યાંત નામના અનુતર વિગાનને વિંં દેવપણે ઉત્પન્ન થયા. લાં છ ગિતોની આયુસ્થિતિ દેશે ઉણી અત્રીશ સાગરાપમની અને મહાાગ રાજ્યની સંપૂર્ણે જનીશ સાગરાપમની હોતી હવી.

ત્યાંથી પ્રથમ છ ભિતોના અને પછી મહાાગ કુમારના જીવ ચનીને કયાં કયાં ઉત્પન્ન થયા અને મહાાગ કુમારને પૂર્વે જાંખેલા કર્મ કરી રીતે ઉદ્ઘાંય આબ્યા તે આગળ કાઢીશું. આપૂર્ણી.

શ્રી જૈનધર્મ પ્રકાશ.

સંબોધસત્તરી.

(સંબોધ પાઠે ૮૩ થા.)

(જયણુ)

૧૭ મી ગાથાના અર્થમાં જિતપૂજામાં જ્યાણ રાખવા સંખ્યા પાછલા અંકમાં કેટલું લખાયું છે. હવે બાકીના ધર્મ કૃત્યોમાં પણ જ્યાણની આસ નજર હોવાથી તે સંખ્યામાં કેટલું લખવાની નજર છે.

સામાયક—સામાયકને ભાટે એક સુહૃત્ત (એ વડી) નો દળ કહેદો છે જેએલા વખતમાં આવકને સાધુપણું પ્રાપ્ત થયું હોવાથી મુની મહારાજાની પેટે ડક્તાં, બેસ્તાં, વાતચીત કરતાં, શરીર ફેરવતાં અથવા બીજું દેંકે કાર્ય કરતાં ચરવળા અને સુદુપ્તિનો યથાર્થ ઉપયોગ કરવો નોમણે. આવકના ઉપગરણ્યમાં ચરવળાની આસ નજર હોવા છતાં કેટલાંએક તો બીજુલ રાખતાજ નથી અને કેટલાંએક રાણે છે તો તેઓ તેનો ઉપયોગ બરાબર કરતા નથી. નહીં રાખનારા ઉભા થઈને પ્રતિકભણુની કિયા કરી શકતા નથી, પંચાંગ પૂર્વક અમાસમણું દ્વારા શકતા નથી, વાંદળાના રૂપ ચાવસ્યક સાચની શકતા નથી તેમજ ચુણ માદારાજને અમાવસ્યાને પ્રસગે સમિપે જઈને પાદતળને સ્પર્શ પણ કરી શકતા નથી. માત્ર ફેંકટજ ‘એસણે સંહીસાઉ’ અને ‘એસણે ઠાઉ’ ના આદેશ માળે છે^૧ વાંદળામાં અવગણમાં પ્રવેશ કરવાની આજા નીરથીક માળે છે તેમજ અહાર નીકળયું ન છતાં આવસ્તિઆએફેંકટ કહે છે. અમાસમણમાં મધ્યએળવંડામી કહીને ભસ્તક ભૂમિને લગાડવાને અદ્દે ભાત્ર અર્ધ અવનત (અરવું નમાવવું) જ કરે છે. આ પ્રમાણે ધર્મની અપૂર્ણ વિવિ કરે છે. અને ચરવળાના રાખનારાઓમાંથી પણ કેટલાંએક તો પરવાનો ગળવાથી નેમ દર્થીઓ રાખી શકાય તેમ ચરવળા પાસે હોવાથી ડી એસી શકાય, ફીલરી શકાય અને જઈઆવી પણ શકાય એમ સમજ ને પ્રમાણે વર્તે છે. પરંતુ

૧ ઉભા રહીને સામાયક લેનાર આવક એસીને સત્તાયધ્યાન કરવા ગારૂ એ આદેશ માળે છે પણ ને એસીનેજ સમાયક લે છે તેને એ આદેશ ભાત્ર પ્રવર્તીન હોવાથીજ માગવાનો છે.

संघात्सत्तरी.

७३

ते सधणा कर्यमां इतां इतां, उतां ऐसतां जभीन विग्रे प्रमान्त्रजानो
उपयोग राखता नथी, वांछां हेतां संआसा पठिलेहवानो उपयोग होतो न-
थी तो वांछानी पटीलेहखा तो पूरी शेनीज करे! आ आत्मां ऐम
समजवानी जड़र छे के चरवणा विना शरीर, वस्त्र, उपगरण, भूमि वि-
जेरे प्रमान्त्रजानुं अनी शक्तुं नथी अने मुनिपत् ज्येष्ठा पणी शक्ती नथी
ते चरवणा होवाथी अनी राडे छे आटे तेमां सावधान थनुं. मुहूर्पतीनी
जहरीआतना करण पण समजवा अने ऐवजवाने वणते मुख पासे मुहू-
र्पती राणीनो शाहदेव्यार करनो. आ सधणी आत्मोनो समावेश ज्य-
ेष्ठाना पेटामां थाई जायछे.

पोसह—सामायकने भाटे जेम ए धडीनुं काण प्रमाणु छे तेम पौ-
पधनुं १२ क्लाक (१५ मुहुर्त अथवा नीश धडी) तुं तेमज तेथी बम-
णुं प्रमाणु छे ते गोसह अहोरात्र (रात्र अने द्विस) नो क्लेवाय छे.
सामायकनो काण मात्र ए धडीनोज होवाथी तेमां तो मात्र सजायध्यान के
प्रतिक्षमण्णनी क्लियाज करवानी होय छे परंतु पोसहमां तो आओ द्विस
रहेवानुं होवाथी शरीर संबंधी आवानी, खीवानी, गेसवानी, उठवानी,
शयन करवानी, लघुनिति वडीनिति करवानी विग्रे अनेक क्लियाच्चा करवी
पडे छे तेथी ते सधणी क्लियाच्चोमां ज्येष्ठा पाणवानी जड़र छे. पोसह
केवो ते मुनिपण्णानो नमुनो छे तेथी जेम भालना ज्येष्ठामां नमुनो वधारे
सुंदर होय छे तेम एक द्विसना चारित्रध पोसहमां मुनिमहाराज जेओ
यावनश्चित चारित्रना पाणनारा छे तेना इतां विशेष प्रकारे प्रतिक्षमण्णु,
देववन्दन, पठिलेहखा विग्रे क्लियाच्चोगां सावधान रहेनुं ज्ञेहच्चे अने ज्य-
ेष्ठा रहीत केाध पण कार्य करवुं न ज्ञेहओ.

प्रतिक्षमण्णुमां ज्येष्ठा पाणवा संबंधी भीनानो समावेश सामायकना
पेटामां थपेक्षा छे.

तीर्थयात्रा—आनेके धरे रक्षा थका पण दरेक कर्यमां ज्येष्ठा पाण-
वानी छे तो तीर्थयात्रामां तो विरोप प्रकारे पाणवानो ज्ञेहओ. ज्ञेके क्लेवाक
यात्रागुओने गाटे एथी विपरितपणुं ज्ञेवामां आवे छे परंतु ए तेओनो
मोटी भूक्ष छे. धरे रहीते तपस्या करनारे तीर्थ स्थानके विशेष तपस्या क-
रवी ज्ञेहओ. धरे रहीते खार निवि लीक्षातरी न खानारे तीर्थ यात्रामां

વિશેષ પ્રકારે ત્યાગ કરવો જોઈએ, વરે રહીને પરે દિવસે તથા લિખિતે અભિયર્થ ગાળનારે તીર્થયાત્રામાં સર્વચા દિલ્લી પાળનું જોઈએ. વરે રહીને રાંધવા રંધવવામાં તથા ચાલવા હાલવામાં યતના રાખનારે તીર્થ યાત્રામાં વિશેષ પ્રકારે યતના પાળની જોઈએ. મુળતો પગે ચાડીનેજ તીર્થયાત્રા કરવી જોઈએ. પરંતુ તથા પ્રકારની શક્તિનો અભાવ હોવાથી કદી વાદત પડે તીર્થયાત્રા કરવાની હેઠા તો તેમાં પણ અહુ વિકેટ પૂર્વિક જ્યાણું પાળવી જોઈએ. કદી રેલવેની મુસાફરી તો પરસ્વાધિનપણુંની હોવાથી તેમાં કાંઈ ઈલાજ નથી પરંતુ ઐલગાડીના ડે વૈડાગાડીના ઐસનારે ઔદ્ઘરુલ જ્યાણનો વિચાર કર્યા શિનાય રાતોરાત ચાલનું અરભી રાતે ચાલનું કે પાછ્યા રાતે ચાલનું તે દેખ્ખીનું કેવું વિપરીત છે! વળી ચોમાસાની ઝડુમાં જ્યારે ચારે બાળુ લીલેતરી ઉગી ગઢ હોય, અનેક પ્રકારના અજંતુંગોની ઉત્પત્તિ સ્થાને સ્થાને થદ ગઢ હોય અને ગાડીની તેમજ પગે ચાલવાથી પણ બેસુમાર જીવદિંસા થતી હોય તેને પ્રસ્તુતે તીર્થયાત્રા કરવા જરૂર આવનું તે ધરીત નથી કારણુંકે તેમાં જ્યાણું ઔદ્ઘરુલ પળી શકતી નથી. શેષ કાળમાં યાત્રા કરવા જનારમાથી ડેટલાએક યાત્રાળુંએ યાત્રા કરવા નીકળ્યા છે તેવો ઉપયોગ પણ રાખતા નથી અને આપકના આચારથી વિપરિત પણે આદાર વિદાર કરે છે. આ સંબંધમાં વિશેષ લખવા કરતાં યાત્રાથી જૈનબંધુઓ સ્વયમેવજ પોતાના કર્તૃવ્યનો વિચાર કરશે તો યાત્રાની સાર્થકતા થશે.

સ્વાભિવચ્છળ—પૂર્વે કૃત પુણ્યોત્ત્વ પડે પાંચ રૂપીઆની સારી રીતે પ્રાસી થાય લારે તે દ્વયને પોતાના ઉપભોગમાં લેવા કરતાં ઔજન સ્વધર્મ બંધુઓને તેનો લાભ આપવો તે વિશેષ પ્રકારે છેદ છે. એવાજ શુભ હેતુ પડે પોતાના કર્તૃવ્યને સમજનારા આપક ભાસુંએ સાંસારિક પ્રસ્તુતોમાં વિશેષ દ્વયનો વ્યય ન કરતાં નાના મોદા સ્વામીવચ્છળો કરીતે તેમાં દ્વય વાપરી પુણ્યાનુઅંશી પુણ્ય ઉપાર્જન કરે છે. કોઈ સામાયક કરનારને જમાડે છે, કોઈ પ્રતિક્રિમણ કરનારને જમાડે છે, કોઈ પોસાડ કરનારને, કોઈ ચતુર્થ વ્રત ધારીને અને કોઈ આર વત્તધારીને જમાડે છે તેમજ કોઈ મોહું સ્વામીવચ્છળ કરી સર્વે આવક ભાઈઓને જમાડે છે. હવે એ સખ્યાતાના મોદા સ્વામીવચ્છળોમાં જીવની જ્યાણું પાળવાની ખાસ જરૂર છતાં નેનો બહુદ

संषाधसत्तरी.

७५

ओहो विचार राखवामां आवे छे. छव नंतुओनी तपास कर्याविना रात्री छतां शूलयो सगालवामां आवे छे. धान्यने गाए पूरो तपास कर्याविना जे-भनु तेम ओरी देवामां आवे छे. रात्री छतां कडोण पगालवामां आवे छे जे उ वधारे वर्षत पाण्हीमां रहेवाथी डगी नव छे अने अनांतकाय युक्त थाय छे, अनाजना घोण विग्रेरुं नीकेलुं उपशु नजा दोणी नांभती व-भत जगीन उपन्ना छवोना नाशनो विचार पण राखवामां आवतो नथी. अनेक छवोनी उत्पत्तिवाणी विवायती कडेवाती संचानी पउस्तीनो शेरो विग्रे पक्वान राखवामां आवे छे. वारी गण्याय तेबुं शेरो विग्रे पक्वान भाव घोताने धरे वासी न राखतां वासी राखनाराते वेची नाखवामां आवे छे, हजरो इपैआतो खर्च कर्ने पाळग पांच इपैआना अवा वेचाणु तरइ पण उद्वरता अताववामां आवती नथी. वासी गण्याती ज्वेषीने आ-यड पूर्वक जमाऊना विचार करवामां आवे छे. रांधेलु अनाज पाढण व-धुं होय ते डेट्लीक वर्षत रातनासी रहेवा हेवागां आवे छे, कही तेनो नि-अव करे छे तो अहां हाम वासेहो नेमना तेम रहेवा हेवामां आवे छे. भीवा गाए तेमज वापरवा भाटे आवतुं पाण्ही भरार गण्यातुं नथी. ग-णाय छे तो भाव लोकेने देखाऊ आतर वासणु उपर गण्याणुं खंधाय छे परंतु तेनो संभारो दुःखाया करे छे अने छेटे पण ते संभारो पाण्ही लावेवा कुवा विग्रे जगाशयमां मोक्षवामां आवतो नथी. आवा अनेक कारणो छे उ जेने भाटे ज्येष्ठानी आस जहर छतां पाण्हवामां आवती न-था. प्रसंजोपात् लभवानी जहर छे उ डेट्लायेकतो स्वामीवच्छणनी चां-हर पाताना संभंधवाणाओनेज अहोगे भागे जमाउ छे अट्टहुंज नहीं प-रंतु धर्मीज जनोने भुली जवामां आवे छे. स्वामीवच्छणनो हेतु अहु क-राने निरंतर धर्म ईश्यामां तत्पर रहेनाराओने जमाऊनो छे तो तेमने आजु उपर राखी घोताना लागता वणगता, सगा संभंधी अने नेकर चाकरो केंद्रो स्वधर्मी तेमज परधर्मी होय छे अयवा तो धर्मधी पराङ मुख अने डेट्लायेक हुराचारी पण होय छे तेमनेज बहेगे भागे जमा-उवा अने तेने स्वामीवच्छण लेखतीने तेनो खर्च शुभ आते गण्यवो ए-न्याय युक्त नथी.

गुरुभक्ति—अनेक प्रकारे थाय छे. वहां नमस्काराद्विते गुरुभक्तिवडे

૭૬

શ્રીજૈનર્થમ् પ્રકાશો.

થાય છે. આદાર પાણી, વસ્ત્રપાત્ર, આસન શયન, વસ્તી વિગેરે આપવાથી ભક્તિ થાય છે. ગુરુ આવ્યે સામા જરૂર, સાર્વેણું કરવું કરવાનું, તેમના વચન અતુસારે વર્તેનું, આપધ ઉપયારની સંભાળ રાખવી, સાનાભ્યાસના સાધનો મેળવી આપવા અને ભીજ અનેક પ્રકારના ધર્મકાર્યો ને તેઓ બનતાવે તે કરવા તેથી પણ ગુરુ ભક્તિ થાય છે પરંતુ એ સધગામાં વિવેક સુક્ત જ્યથ્યાની જરૂર છે. એમાંનું ડોષ પણ કાર્ય ઉપમોગ રાખ્યાવિના નિશાંકપણે શ્રવ વિરાધના તરફ દૃષ્ટિ રાખ્યા શિવાય કરવાનું નથી. આ સંબંધમાં વિરોધ લખવા કરતાં દરેક કાર્યની સમજણું ગુરુ સુઝેજ સારી રીતે મેળવવાની જરૂર છે.

આ પ્રમાણે દરેક ધર્મકાર્યગાં જ્યથ્યાની જરૂર સમજવી અને જ્યથ્યાનુક્ત દરેક કાર્ય કરવું જેથી તેના પરિપૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ શકે.

તથાસ્તુ.

મનુષ્ય જન્મ.

અનેક પ્રકારના પુણ્ય સંચયપણે આ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રથમ શ્રવ ગર્ભમાં આવે છે લારે એક સખ્ય મનુષ્યને સાડા વણું કોડ રોમરાયમાં દરેક રોમરાયે લોઢાની તપાવીને રક્ત કરેલી જોય વોંગવાથી જેટલી પીડા થાય છે. તેટલી પીડા થાય છે ત્યાર પછી ગર્ભની અંદર નર ગાસ પર્યનું અનેક પ્રકારની અશુચિમાં જિધે મસ્તકે રહેણું, ઇધિરાંતિક મદા હૃદાંનુંનીક પદાર્થોનો આદાર કરવો અને તદનમુચ્છિત અવસ્થામાં રહેણું; પાંતે પ્રસવ સંમયે ગર્ભમાં ઉપજવાના સમયની પૂર્વોક્ત વેહના કરતાં આડ ગુણી વેહના બોગવાની, અને આઠણું બધું છતાં પણ જાણે તે હૃદાં કાંઈ લોગન્યુંન નથી એમ લક્ષમાં રાખીને જન્મ પર્યનું અનેક પ્રકારના પાપ કર્મો કરવાં એ કૃટલી બધી અજ્ઞાનતા છે।

ગર્ભાવસ્થાના અતિક્રમણું પણી બાયાવસ્થાની અંદર પણ અવ્યક્ત અવસ્થા બોગવાની, પરતંત્રપણે આદાર નિદરાહિક કરવું, ગમે તે વ્યાધિ શિતપન થયો હોય તો પણ બાબ ચેદાથી જે વ્યાધિ સમજ રાપાય તેને અતુસરીને અણુગમતો કરું જૌયાવો પીવાં, મુળમાં રગહોળાનું, પણતત્ત્વ ગમ-

મનુષ્યજીનમ.

૭૭

નાગનન કરતું, આવી અનેક દુઃખની શ્રેણીઓ છે તેને ભુલી જઈને આ-
ગળી અવસ્થામાં પ્રાણીઓ અનેક પ્રકારના છળ કપટ કરે છે એ તેમની
મેરી શુદ્ધ છે.

બાલાવસ્થા પૂરી થયા પછી યોવનાવસ્થામાં પ્રવેશ કરે છે અને એ
અવસ્થાને સબજો કાળ પ્રથમ તો સ્વી વિલાસમાં અને પછી દ્રવ્યોપાર્જન-
માં ગુમાની હે છે તેમાં પણ કામી મનુષ્યો વિવયાંધપણુથી પોતાના ભિત્પત્તિ
સ્થાનને વિશેષ પ્રકાર અનુરક્ત થઈને જણે ક્રીતે ગર્ભાવાસમાં આવતું જ
પડવાનું ન હોય તેમ વર્તે છે. સ્વીના અનુરક્તપણુમાં પર્વ તિથિએચે શિ-
શિયણ પાળવું તો આજુ ઉપર રહ્યું પરંતુ ભીજ અનેક પ્રકારના કર્મ અ-
ધન કરે છે, ભક્ત્યા ભક્તનો પણ વિવેક રાખતા નથી. દ્રવ્યના ઉપાર્જનમાં પ-
ણ અનેક પ્રકારનાં છળ, કપટ, પ્રપંચ, વિશ્વાસધાત, અસત્ય ભાપણ, ધર્મા,
સ્પર્ધા, અદાન અદાણ અને ગુણાની વૃદ્ધિનું બહુ પ્રકારના પાપ આરંભ
કરે છે. જેના પાપનું પ્રમાણું પણ બાંધી રાખ્ય નહીં તેવા બ્યાપારો કરે છે
વાણ ઐડાવે છે, ઇના આદ કરે છે, મીઠો અંધાવે છે, ન કરવા ચોગ્ય ચી-
નેના બ્યાપારો કરે છે, એ સુમાર જીવો પડી ગયેલું અને એકમાણું ભરતા
અનેક જીવેનો નાશ થાય તેવું અનાજ નિઃશંકપણે વેચે છે, પ્રવાહી ધૂત
તૈલાદિ બ્યાપારમાં તેમજ અનેક વસ જીવેના નાશના હેતુભૂત ગોળ, ખા-
ડ અને સાકર વિજેના બ્યાપારમાં ભીલકુલ કરણુંની નજરે લેતા નથી;
માત્ર પૈસો, પૈસો ને પૈસોન રાત વિસ જંઘ્યા કરે છે. પૈસાને માટે પર-
દેશ જય, વલાણે ચડે, અટવીનું ઉલ્લંઘન કરે અને જીવતબ્યના સંશય થઈ
પડે તેવે સ્થાનકે જય; જોડી સાક્ષીઓ પૂરે, જોયા નામાંઓ લખે, જોયા
દસ્તાવેજ કરે, થાપણ ઓળખે, તોલ માય જોયા રાખે તેમજ ને પ્રકાર
દ્રવ્ય પ્રાપ થાય તેમ કરે. પરંતુ તે વખત એટલો પણ વિચાર ન કરે કે
આવા પાપાચરણવડે મેળવેલું દ્રવ્ય કાંઈ મારી સાથે આવશે નહીં અને
તેના પાપના ફુલો મારે એકલાંબેજ બોગવવા પડશે. દ્રવ્યનો તો સ્વજન
કુંઝાંધી, બાધાંદો કે મુત્રો ભાગ પડાની જશે પરંતુ તેના મહા માંદાં ફુળ
બોગવતી વખત તેણો ભાગ પડાવશે નહીં. આવા ઉત્તમ વિચાર વડેજ કા-
ળકસરીઓ કસાઈનો દીકરો ફુળ ક્રમાગત પાપાચરણને સાગી શુભ ગતિનું
ભાજન થયો હતો.

“ રાજભેદી નગરીમાં દરરોજ પાંચશે પાડાઓને મારનાર કાળકર્મી.

ओं कसाई रहेतो होतो अने ते ओवा कनीष आचरणुनडे पोताना अहोणा कुदुंखुं प्रतिपादन अरतो होतो. तेने महायण नामे पुन रहो. पूर्वभवना पुन्य योगथी तेने अभय कुमार मंत्रीधर साथे निवाई थर्ह दती. समर्पिती ज्ञव विना अभय कुमारनी निवाई भीजने होय ओवो सिद्धांत होतो. अरण्य पर्यंत पापाचरण इरीति शागकस्त्रीओं सृतु पापी सातमी नरके गयो. पाषण तेना कुदुंख वर्णे भणीते महायणने कुदुंखनो अभिकारी स्थापन कर्यो अने तेना पितानी प्रभाषु पांचरो पाडाओं हिनपत्ये हण्ठीने कुदुंखनो निर्वाह यत्वाववाहुं कहुं. गणायणतो सत्संगतीना योग वडे ह्यायुद्धा प्रथायाभवाणा होतो तेथी ते योलो के “हे कुदुंखीओ! मारा पितानी प्रभाषु हुं पाप कर्म आचरीश नहों कुमके ए प्रभाषु आचरेला पापथी भेळवा द्रव्यने तो तमे सर्वे भेळवो अने तेथी उत्पन्न येणेला पापने भारे ओकलाएज भोगवां पडे.” कुदुंखीओ ऐस्या के “हे गडाजग! अमे कांडी ओवा कृतक्षी नवी भाटे नेम तारा उपार्नन करेला द्रव्यमां भाग लेशुं तेम तारां पाप पण् अमे वेंची लेशुं. नेवी तारे ओकलाने भोगवां नहीं पडे.” कुदुंखना आनां छण भरेलां वयनने असल्य हराववा भाटे अने पाप वेंची केवातु नवी तेग हुःभगां भाग पडावी शदतो नवी नेम घतानी आप्या भाटे तरतज महायणे एक कुबाईने पोताना पग उपर प्रहार करीन भोडा धा पाडी दीघो अने घतान येवेली पीडाने भाटे असल्य पोहार करवा भांडयो. कुदुंखीओ प्रते कहुं के “गते गेसुभार पीडा थाय छ भाटे परभवमां ज्यारे परमात्माभीओ पूर्व भवगां करेला पापमैने याद आपी आपीने हुःण हेशे त्यारे भाग पडाववानी वाततो आज्ञु उपर रही करण्यु के व्यंतरोने आपवाहुं यगीतन जगाणतां नेम जुहे जुहे स्थानके दरेक दाण्डा भी ज्य छे तेम चा भवना तथा पाढला भवना करेला पाप कर्मावडे तमे सर्वे जुही जुही गतिमां चाल्या जशो लांची तमे भारी पीडामां भाग पडाववा शुं आववाना हता! पण् आ भवमां भारी सगिये ऐडा छो ल्यारे तो भारी आ वेहनाने योडा योडा भाग पडावी ओछी करो.” कुदुंखीओ सर्वे विचारमां पछा अने योस्या के ‘ओ पीडा तो अभाराथी वेंची शक्य तेग नवी’ भगायणे भितर आप्यो के ‘ल्यारे भारा कर्या हुं भोगवीश परंतु ह्वे तमारा पाप वेंची केवाना प्रपञ्चमां भोगवाई जधते ब्रह्म पापतु बंधन नहीं कहः’ महायणे ह्यानुं अडे स्वदृप

મનુષ્ય જગત.

૭૬

જાણેલું હોવાથી પોતાના અનિ કનિષ્ઠ ધર્મને તજ દઈને આભયકુમારના કહેવા પ્રમાણે ધર્મારાધન કરી સહગતિને પ્રાપ્ત થયો.”

ઉપરના દટ્ટાંતર્થી દરેક પ્રાણીઓએ જહુ પ્રારતો ધરો લેવા જેવું છે. પાપાચરણ કરીને પૈસો મેળવવો તેના ભાગીદારતો કુદુંખીઓ, ભાઇઓ કે પુત્રો થઈ જય અને તેતા ઇશ પોતાનેજ લોગવયા પડે એ કરું હુઃખદાયક છે! એવો સુર્પ કોણ હોય કે વધારો તો ભાગીઆઓને વેચી લેવા હૈય અને હેવું સંધળું પોતે એકલેજ આપે! એટલા ઉપરથી સુજ જનોએ દ્રવ્યોપાંજનમાં પાપકર્મથી અલગ રહેવું અને સદજ પાપકર્મવડે ભગેલી લંઘમનો ધર્મ કર્યાં સહપ્રેયાગ કરી આત્માનું કાર્ય કરવું. પરંતુ જન્મ પર્યત લક્ષ્મી તો ઉપાંજન કર્યા કરવી, પારો આંધ્યા કરવાં અને તે લક્ષ્મીનો ધીલંઘ સહપ્રેયાગ ન કરવો લારે તો પછી એક ગંજુરની ચેઢે તેણે પુત્રાદિકોને માટે પૂર્વ ભવતું હેવું હોવાથી માત્ર મનુષ્યોજ કરી એમ હે. કેટલાએક આજીવની પોતાની યુવાનસ્થા આ પ્રમાણે જાતી જવા હૈય છે.

હવે યુવાવસ્થા વીલા પદી જ્યારે વૃદ્ધાનસ્થા પ્રાપ્ત થાય છે તારે શરીરમાંથી શક્તિ ઉડી જય છે, આંખે જોખું દેખાય છે, સુંધવાની શક્તિ ધરી જય છે. દંતની બ્રેલ્યુની કુરી જય છે, મોદામાંથી લાળ જરે છે, અંગોપાંગ સંકુચીત થઈ જય છે, ચામડીમાં કરચરી પડે છે અને અણ છુટકે લાકડી લેવી પડે છે; આને સમયે પણ પામર મનુષ્યોની દ્રવ્ય તૃણણું કે વિના તૃણણું મટતી નથી એટલુંજ નહીં પણ ઉલ્લી વૃદ્ધિ પામે છે કદી ધરતી દેખાય છે તો તે માત્ર શરીરની અશક્તિથી, પરંતુ તેનું ગન હજુ પણ સંસારથી વિરક્ત થઈને ધર્મકર્યમાં નોદાનું નથી. મોક્ષમાળા નામની શુકમાં કણું છે કે—

કરોચલી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો,
કાળી કેશપદી વિષે, ખેતતા છવાઈ ગઈ;
સુંધવું સાંભળવું ને હેખવું તે માંડી વળ્યું,
તેમ દાંત આવળી તે, ખરી કે ખવાઈ ગઈ;
વળી કેડ વાંશી હાડ ગયાં અંગરંગ ગયો,
ઉદ્વાની આય જતાં, લાકડી લેવાઈ ગઈ;
આરે! રાન્યાંડ એમ યુવાની હરાઈ પણ,
મનથી ન તોય રાંડ, મમતા મરાઈ ગઈ.

શ્રીજૈનર્થમં પ્રકાશ.

આવી દુઃખદાયક વૃદ્ધાવસ્થા પ્રામ થર્ડ હોય છે તે છતાં પ્રાણી તે વખતે પણ ધર્મકાર્યમાં ઉદ્ગમ કરતો નથી. પુત્ર પરિવારાદિતે તપસ્યા વિગેરે શુભ કાર્યોમાં તેમજ શુભ માર્ગે દ્રવ્ય વ્યાપકવામાં જીવન કરતા હેણે છે તો સતોષ માનવાને બદલે ઉલટો મનમાં દુષ્ટવાય છે. પુત્રાદિક કરતાં પોતાને વિરોધ જીવાની ગાળવી સુઅતી હોયની તેવું જણ્યાવે છે. આખી જીવાનીમાં કરેલાં આરંભાદિકના નિવારણુ માટે આ અવસ્થામાં પ્રયાસ કરવો તો આજુ ઉપર રહ્યો પરંતુ ઉલટાં નવીન આરંભાદિક કારણો નેડોને પાપકર્મ બાંધે છે તેમજ એવા પાપકારી કાર્યોની પાછળ એણી ચાલ્યા કરે એવું કરે છે. લાખો હપીઓની મીઠકત હોય છે તો તેમાંથી પાંચ સાત પુત્રોના ભાગ પાઢવાની જોડવણુ કરે છે પરંતુ એક ભાગ પોતાનો કાઢીને તેનો ધર્મકાર્યમાં ઉપયોગ કરવાની જોડવણુ કરતા નથી. પોતાના ભૂત્યની પાછળ જે કે ‘આપ મુચ્ચે સારી દુષ્ટ ગાંધ હુનીએ’ એ પ્રમાણે છે તોપણ પાછળ ખી પુત્રાદિક લડે નહીં, તકરાર થાય નહીં, વાંધો પડે નહીં, એવી તજવીજ કરવાને માટે અંત સમય ર્યેતી પ્રયત્ન કરે છે પરંતુ પોતાના પર ભવમાં અનેક પ્રકારના દુઃખો સહન કરવા ન પડે તેને માટે ઘીલડુલ પ્રયત્ન કરતા નથી. પોતે તેમજ સ્વજન વર્ગે સર્વે જણે છે કે હવે આ છેલ્લી પથારીમાંથી ‘ડોસાળ’ ઉદ્વાના નથી તોપણુ અભક્ષ ભક્ષણુ તથા રાત્રી જોજનાદિક અનેક કારણો સેવાને પણ શરીરનો ઉપચાર કરવામાં તત્પર રહે છે. મધ્યમાં ઔષધ વાપરે છે, આહુના રસમાં ઔષધ લે છે, રાત્રી છતાં શક્તિ માટે કંળ વિગેરે પદાર્થોનું જોજન કરે છે અને ડોન રીતે સામ થયાય તેવું ચાહે છે પરંતુ પરભવમાં આવી પડનારા વ્યાધીના નિવારણ માટે ઘીલડુલ ઉપચાર કરતા નથી. પાછળ રહેનારા પુત્ર કળનાદિને માટે (મુત્તુ પત્ર) કરે છે પરંતુ પરભવ સંબંધી વીલ (પોતાના પુન્ય પાપનો દિસાય) કરતા નથી કે જેથી પોતાના પાપનો પસ્તાવો કરવાના વખત મળે અને તેના નિવારણને માટે અનતા ઉપયોગ લઈ શકાય. કુંડામાં જોટલુંજ કે આનખી જીવાનીની વાત તા આજુ ઉપર રહી પરંતુ છેલ્લી ધરીઓ પણ પોતાના કર્તાંવ્ય કર્માનો વિચાર કરતા નથી તો પછી તેની ગતિ આશી શુદ્ધ વિચાર કરવો? એટલેજ વિચાર કે ક્યાંતો તેને સહગતિની અપેક્ષા નથી અચળા તો એ વાતનો તેણું વિચારજ કરેલો નથી કે પરભવમાં આં જરૂર પડશે અને શું થશે?

હવે મતુષ્યજનન્મ પામીને વાંચ્યીત સુખની ધ્યાનવાળાએ કેવી રીતે તેને મેળવું તે બાયતમાં શ્રી સિંહર પ્રકરણમાં કહ્યું છે કે— અપૂર્વુ.

आहुकोने नवा वर्षनी भेट.

जैन पंचांग.

तिथिएमानी वधवद वार्षिक जैनपर्व, तिथि, वार, ध्येय तारीख,
दिवस अने रात्रीना चैधडीआना यंत्र तथा सूर्योत्तम
सूर्यस्तनो वणत विग्रे खतावनारू तपागच्छनी स-
भायारी प्रभाषेतु जैन खंडुओने उपयोगी
वार्षिक पंचांग

(संवत् १८४८ ना चैत्रश्ची संवत् १८४९ ना इगण्डु सुधीतु)
किंभत एक आनो.

आहुकोने लेट तरीके भोक्लावेल छ. पञ्चीसथी वधारे न-
झल मंगावनारने भाट अरधा आना प्रभाषे आपवामांआवरो.

आहुकोने अगत्यनी सूचना.

हेरे क आहुकोने लवाज्जम भोक्लवा साथे लेटनी युक्ता
पास्टेज भाटे अरधो आनो प्रथमथीज वधारे भोक्लवो जेथी
लेट भोक्लतां विलंब न थाय अने आहुकोने अरधो आनो भो-
क्लतां खोले अरवो आनो अरवो न पडे.

आहुकोने विशेष लाभ.

चरितावकी अथवा जैनकथा संग्रह.

किंभत हाठ इपीओ पास्टेज ऐ आना.

प्रथमथी थेला अने नवा थेला आहुकोने युक्ते भोक्ला-
वतां चारे खाण्डु अनी रसीक्ताने भाटे प्रथांसा थृष्ण रही छ.
जूनवर्गने भाटे आवी वांच्यवानी युक्तेनी खाभी डेलेक अशे
आ युक्ते पुरी पाही छ. अना सभवभां अली विशेष लभीन
आवी करावया करतां आहुक थवा धृश्यनार पौते वांच्ये त्यारे
अथवा तो वांच्यवाने पुछशे त्यारे खर आवी थृष्ण जशे.

युक्त अहार पडया पडी लेडे किंभत वधारेली छे तोपाण
आ चैपानीआना आहुको पौते मंगावरो अथवा तेनी भारद्वत
झीण्डु काढ भंगावरो तो तेने भाटे हण्डु पण्डु प्रथम प्रभाषेज
(३१-४०) किंभत लेवामां आवरो. सातेरी नाभवाणीना ऐ
आना वधारे लागवे परहेशवाणीने पास्टेज युक्त बेससे.

जैनशागा विग्रे सार्वजनीक उपयोगने भाटे तो कीभत
प्रथम प्रभाषे गवा इपीओज राखेलो छे.

છપાઈને ખહાર પડી છે.

હુંડક હિતશિક્ષા અપરનામ્ ગપ્પદીપિકા સમીર.

કિંમત અરથો રૂપીઓ. પોસ્ટેજ એક આનો.

હુંડક મતના ખંડનમાં અધાપિ પર્યત ધણી અથે લખાયા છે. ધણી બુકો છપાયેલ છે તેમાં આ અથે એંચર વચારો કર્યો છે. આ બુકમાં સુખ્ય તો હુંડકમતિ આવ્યા પાંચતૌની છપાવેલી જ્ઞાન (ગણ્ય) હીપીકાલું ખંડન છે પરંતુ પાછળ એકસો પ્રશ્નેનાં તર વિગેરમાં હુંડકમતિની ધણી કુદુક્ષિયાને અપાસત કરેલી છે. ભાપા હિંદુસ્તાની પણ મુખ્યી રીતે સમજી શકાય તેવી છે. અક્ષર શાસ્ત્રી છે. પુઠા પાકા ખંધાવેલ છે. બુકના અને પયાસના પ્રમાણેમાં કિંમત વધારે નથી. નવા બાહુકોને માટે પણ પ્રથમ પ્રમાણેજ કિંમત રાખેલી છે. જોઈએ તેણે મંગાવની. કિંમત પોસ્ટેજ સાથે નવ આના મોકલબા.

લવાજમની પહોચ.

૭—૨ શા. જમેનાદાસ ગલુક્કયંદ	૨—૬ વકીલ. નંદલાલ લખુભાઈ.
૬—૮ શા. અલેચંદ રાયયંદ	૧—૩ શા. મગનલાલ કુદેરાસ.
૧—૩ શા. અવરાજ જેશંગ	૦—૮ શા. મગનલાલ રવયંદ
૨—૬ શા. તેજકશ વેણીયંદ	૧—૩ શા. અવરાજ ગુલાયંદ
૪—૮ શા. હરીઅંદ રાવળ	૧—૩ શા. ગોકળજ હંસરાજ
૧—૪ વેરા. દેલતરામ ઉમેદમલ	૧—૩ શા. વીરયંદ પ્રાગળ
૨—૬ શા. દેવરાજ સુલયંદ	૧—૩ શા. મગનભાઈ રાયયંદ
૧—૦ શા. દુલભ લખમીયંદ	૧—૩ શા. સુરયંદ નાનાભાઈ
૨—૬ શા. વેણીયંદ સુરયંદ	૨—૬ શા. મગનભાઈ કસુરયંદ
૧—૦ શા. મોતીયંદ ડોસા	૧—૩ શા. ગલુક્કયંદ તારાયંદ
૧—૬ શા. લખુભાઈ ધનજી	૧—૩ શા. કાળીદાસ જગન.
૨—૬ શા. છગનલાલ અવરાજ	૨—૬ મેતા. ગુલાયંદ નીચાલયંદ
૧—૩ દેશીન મુશાલયંદ ગાણેક્કયંદ	૩—૦ શા. નેગયંદ પીતામર
૨—૬ શા. રવળ જેચરદાસ.	૪—૦ શેઠ. હેગયંદ પ્રાગળ
૧—૩ શા. વરતારામ સાંકલયંદ	૦—૧૪ વેરા. લીલા કીડા
૧—૩ શા. દેવીશંગ રાશુજી	૨—૧૨ શા. ગેરાજ શાગળ
૧—૪ સારંગીયામેરવદાસનાનુમલ	૧—૮ શા. સુળયંદ કાળા
૨—૦ શા. ચુનીલાલ મોતીયંદ	૪—૮ શા. જગળુવન વરધમાન
૧—૩ શા. રાયયંદ પ્રેમયંદ	૨—૦ વકીલ. દીપયંદ નીલુવન
૧—૩ શા. બાલાભાઈ મગનલાલ	૨—૬ શા. તારાયંદ ગલુક્કયંદ
૧—૩ વેરા. હીરાયંદ લખમીયંદ	૨—૬ શા. વનમાળા દેવયંદ

ટ્પાલમાં દીકીટો તથા બુકો જેરલે જાય છે તેથી બાહુકોએ મનીએડરથી લવાજમ મોકલનું અને બુકો વેદ્યુપેખતથી મંગાવની.